

હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે “સોયાબીન અને મકાઈની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી તથા એડેપ્ટીવ ટ્રાયલ અંગેની એક દિવસીય કેન્દ્રીય ખેડૂત તાલીમ કાર્યક્રમ” યોજાયો

હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે “ સ્ટ્રેન્ધનીંગ ઓફ એગ્રી. પોલીક્લીનીક ફોર ટ્રાયબલ ફાર્મસ એટ દાહોદ” યોજના દ્વારા તારીખ: ૨૩/૦૬/૨૦૧૭ ના રોજ “સોયાબીન અને મકાઈની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી અને એડેપ્ટીવ ટ્રાયલ” વિષય પર એક દિવસીય કેન્દ્રીય તાલીમ કાર્યક્રમ ખેડૂતો માટે આયોજીત કરવામાં આવેલ હતો. સદર એક દિવસીય કેન્દ્રીય તાલીમમાં દાહોદ જિલ્લાના ધામરડા, ઝાદા, ખરેડી, નગરાડા અને બોરડી ગામના આશરે ૫૦ જેટલા ખેડૂતોએ હર્ષોઉલ્લાસભર ભાગ લીધો હતો. એક દિવસીય કેન્દ્રીય તાલીમ કાર્યક્રમમાં ડો. વાય. બી. ચૌહાણ (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક), ડો. વિકાસ પાલી (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક), ડો. એસ. એ. ચૌહાણ (રિસર્ચ એસોસીએટ), શ્રી આરીફ શેખ (રિસર્ચ એસોસીએટ) અને શ્રી એમ. પી. રામાણી (ખેતી અધિકારી) હાજર રહ્યા હતા. સદર પ્રાસંગિક ઉદબોધનમાં ડો. વાય. બી. ચૌહાણ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકશ્રી એ સોયાબીન અને મકાઈના પાકોમાં સંકલિત રોગ નિયંત્રણ, એગ્રી. પોલીક્લીનીક યોજનાના હેતુઓ અને હલકા ધાન્ય સંશોધન કેન્દ્રમાં થતી પ્રવૃત્તિ વિશે માર્ગદર્શન આપ્યું. જ્યારે ડો. એસ. એ. ચૌહાણ, રિસર્ચ એસોસીએટ એ સોયાબીન અને મકાઈના પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી, ખેતી પાકોમાં જૈવિક ખાતર પ્રવાહીનો ઉપયોગ તથા વિસ્તૃતમાં મોબાઈલ એપ્લિકેશન “ i-khedut” અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં જાગૃતતા માટે ભાર મૂક્યો હતો. ડો. વિકાસ પાલી (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ સોયાબીન અને મકાઈની વિવિધ જાતો વિષે માહિતી તથા સોયાબીનની જાત (NRC-37) વાવણી વાવવા માટે ભાર મુક્યો હતો. શ્રી આરીફ શેખે સોયાબીન અને મકાઈના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણના વિષય પર માહિતી આપી હતી.

એક દિવસીય કેન્દ્રીય તાલીમ પ્રસંગે એક એડેપ્ટીવ ટ્રાયલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડો. વાય. બી. ચૌહાણ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકશ્રીએ એડેપ્ટીવ ટ્રાયલમાં સોયાબીનની જાત (NRC-37) વિશે માહિતી આપી અને ડો. એસ. એ. ચૌહાણ, રિસર્ચ એસોસીએટ એ મકાઈની જાતો GAYMH-1 અને GAWMH-2નું ખાતર વ્યસ્થાપન વિશે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી હિતેશ રાહોડ, શ્રી મહેશભાઈ પરમાર, શ્રીમતી વીણાબેન, કુ. શીતલબેન પારગી (ખેતી અધિકારી) અને શ્રી ઉમેશભાઈ ડામોર, હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદ તેમજ કેન્દ્રના સર્વે કર્મચારીઓએ મદદ કરી હતી. અંતિમમાં એક દિવસીય કેન્દ્રીય તાલીમ અને એડેપ્ટીવ

ટ્રાયલનું સંચાલન ડો. એસ. એ. ચૌહાણ અને શ્રી આરિક શેખ, રીસર્ચ એસોસીએટ એ કરેલું હતું. અંતમાં ઉપસ્થિત સ્ટાફ મિત્રો અને ખેડૂતોનો આભાર માની કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો.

એક દિવસીય કેન્દ્રીય તાલીમના ફોટોગ્રાફ



એડેપ્ટીવ ટ્રાયલના ફોટોગ્રાફ

